

કૃષિ સંશોધન કેન્દ્ર, ડેરોલ ખાતે આત્મા પ્રોજેક્ટ, ગોધરા દ્વારા ખેડૂત શિબિર યોજાઈ

કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનીવર્સિટી, ડેરોલ ખાતે આત્મા પ્રોજેક્ટ, ગોધરા (પંચમહાલ) દ્વારા સ્વચ્છ ગુજરાત અંતર્ગત ખેડૂત શિબિરનો કાર્યક્રમ તા. ૨૭/૦૮/૨૦૧૬ નાં રોજ યોજાઈ ગયો. સદર કાર્યક્રમમાં ડેરોલ કેન્દ્રના વડા ડૉ. આર.જી.મહાર તથા જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બી. એસ. વાળંદ અને જુદા જુદા ખાતાના અધિકારી / કર્મચારીઓ અને કેન્દ્રના સમગ્ર સ્ટાફ ગણ સહિત પુરુષ અને મહિલા ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ તેને સફળ બનાવેલ. સદર કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતાં ડૉ. આર. જી. મહાર, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા કેન્દ્રનો પરિચય આપતા જણાવ્યું કે આ વિસ્તારના અગત્યના પાકો જેવા કે ડાંગર (ઓરાણ), કઠોળ પાકો (મગ, અડદ) ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષે વિસ્તૃત ચર્ચા કરી ખેડૂત ભાઈઓ ઉપરાંત મહિલાઓની ખેતી કાચોમાં અગત્યનો હિસ્સો છે. તેમ જણાવેલ.

જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વાળંદે પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે જાણકારી આપતા જણાવ્યું કે ખેડૂત મહિલાઓ ઘરકામ કરવા ઉપરાંત ખેતીમાં અગત્યનો ભાગ ભજવે છે. અને મહિલાઓનું સ્થાન દિન પ્રતિ દિન ખેતી અને પશુપાલન ક્ષેત્રમાં પણ વધતું જાય છે અને સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત ઘર આંગણે શૌચાલય બનાવવા સરકારશ્રી તરફ થી ચાલતી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. અને વૈજ્ઞાનિક રીતે ખેતી કરી તેમનું જીવન ધોરણ ઊંચું આવી શકે તે માટે વિસ્તૃત જાણકારી આપેલ. તદુપરાંત ખેતી પાકો માં આવતા રોગ - જીવાતની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રના ડૉ. એસ. ડી. પટેલે જણાવ્યું કે પાક સંરક્ષણમાં જંતુનાશક દવાઓ વધારે પડતો ઉપયોગ ન કરતાં સંકલિત જીવાત નિયંત્રણનો અભિગમ અપનાવવો. શ્રી આર. વી. હજારીએ ડાંગરના પાકમાં નિંદામણ નિયંત્રણ વિષે માહિતી આપી કે નિંદામણ થી પાક ઉત્પાદન ઉપર સીધી અસર પડે છે તો તેનું યોગ્ય રીતે નિયંત્રણ કરીએ તો ઉત્પાદન વધારી શકાય છે.

અંતમાં ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ આત્મા શ્રી યોગેશભાઈએ આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ છે.

